

Thursday, 4th Jan 2018

ટ્રેનોના લોકેશન જાણવા ૨૦૧૮ સુધીમાં તમામ ટ્રેનોને સેટેલાઇટથી જોડી દેવાશે



- ૧૦૮૦૦ એન્જીનો અને રેલવેમાં વર્ષાંત સુધીમાં એન્ટેના બેસાડવામાં આવશે

- સેટેલાઇટ દ્વારા ડ્રાઇવરો સાથે વાત કરી શકાશે


ભારતીય રેલવેએ તેની તમામ ટ્રેનોને ૨૦૧૮ના અંત સુધીમાં ઇસરોના સેટેલાઇટ સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે જેથી ટ્રેનોના લોકેશનને જાણી શકાશે અને ડ્રાઇવરો સાથે તેમની કેબિનમાં વાત પણ કરી શકાશે, એમ એક અધિકારીએ કહ્યું હતું. વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં તમામ ૧૦૮૦૦ એન્જીન અને રેલવેમાં એન્ટેના ફિટ કરવામાં આવશે અને ડ્રાઇવરની કેબિનમાંથી તેની પર નજર રાખી શકાશે, એમ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ કહેવું.

'અમે દસ ટ્રેનોમાં તો ટ્રાયલ કરી લીધી હતી અને ડિસેમ્બર, ૨૦૧૮ના અંત સુધીમાં તમામ લોકોઝમાં આ સીસ્ટમ ફિટ કરી દેવામાં આવશે' એમ બોર્ડના એક સભ્યે કહ્યું હતું. તેમના કહેવા અનુસાર નવી દિલ્હી-ગુવાહાટી અને નવી દિલ્હી-મુંબઇ રાજધાની રૂટ પર છ ઇલેક્ટ્રિક એન્જીનમાં આ સીસ્ટમ ફિટ કરાઇ હતી.

રેલવે સત્તાવાળાઓ ઇસરોના સેટેલાઇટઆધારિત સીસ્ટમનો ઉપયોગ માનવરહિત ક્રોસિંગ પાસે થતાં ટ્રેનોના અકસ્માતને રોકવા અને ટ્રેનોની હલનચલન જોવા માટે કરવા વિચારી રહ્યા છે.

ઇસરો સાથે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા રેલવેએ કેટલીક ટ્રેનોના અન્જન પર અવકાશ સંશોધન સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ્સ બેસાડી હતી. ઇન્ડિયન રીજનલ નેવિગેશન સેટેલાઇટ સીસ્ટમનો ઉપયોગ માનવરહિત રેલવે ક્રોસિંગ ખાતે વાહન ચાલકોને હુટર મારફતે ચેતવણી આપવા માટે કરાશે.

પ્રવાસનની જાહેરાતમાં રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત : ચંદીગઢ હાઇકોર્ટ



- પંજાબ, હરિયાણા અને ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશમાં આ નિયમ લાગુ કરવામાં આવશે

- ટ્રાવેલ એજન્સીઓએ તમામ માધ્યમોમાં તેમની જાહેરાતમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે

ચંદીગઢ હાઇકોર્ટ એક મહત્વનો ચુકાદા હેઠળ આદેશ આપ્યો છે કે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા તમામ માધ્યમોમાં અપાતી જાહેરાતોમાં રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવાનો રહેશે. ટ્રાવેલ એજન્સીઓ દ્વારા થતી છેતરપિંડીના કેસમાં વધારો થયો હોવાના અવલોકન બાદ હાઇકોર્ટ આ નિર્ણય જાહેર કર્યો છે.

આકર્ષક યાત્રા-પ્રવાસના નામે લોકો સાથે છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સીઓ પર અંકુશ મૂકતો નિર્ણય પંજાબ-હરિયાણા હાઇકોર્ટ આપ્યો છે. ચંદીગઢ સ્થિત પંજાબ-હરિયાણા હાઇકોર્ટેના આદેશ અનુસાર હવે ટ્રાવેલ એજન્સીઓએ જાહેરાતમાં તેમનો રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર કરવો પડશે. વર્તમાનપત્રો, ટી.વી., પેમ્ફ્લેટ કે ડિજિટલ માધ્યમોમાં આપવામાં આવતી જાહેરાતોમાં ટ્રાવેલ એજન્સીઓએ તેમનો રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો પડશે.

ભૂતપૂર્વ આરએડબ્લ્યુના વડા રાજીન્દર ખન્નાએ નાયબ નેશનલ સિક્યુરિટી એડવાઇઝરે નિમણૂક કરી હતી



કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટિએ ભૂતપૂર્વ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (Research and Analysis Wing -RAW) ના વડા રાજીન્દર ખન્નાને ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે નિમણૂક કરી છે.

તેને નિશ્ચિત મુદત વગર નિમણૂક કરવામાં આવી છે અને આગામી ઓર્ડર સુધી તે પોસ્ટમાં રહેશે. તેમની નવી ભૂમિકામાં, તેઓ એનએસએની અજિત ડોવલને મદદ કરશે.

રાજીન્દર ખન્ના

તેઓ 1978ની બેચ રિસર્ચ એન્ડ એનાલિસિસ (Research and Analysis - RAS) કેડરના અધિકારી છે. ડિસેમ્બર 2014 થી તેમણે નિયત બે વર્ષ માટે RAW નું સંચાલન કર્યું હતું. તેમને RAW માં આતંકવાદ વિરોધી એકમના પિતા તરીકે માનવામાં આવે છે અને જાસૂસી સંસ્થામાં અનેક આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવામાં આવી છે અને તે પાકિસ્તાન અને ઇસ્લામિક આતંકવાદના નિષ્ણાત છે. વિશ્વભરમાં ઇન્ટેલિજન્સ એજન્સીઓના સહયોગથી તે પણ આગળ છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor - NSA)

એનએસએ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (National Security Council - NSC) ના ચીફ એક્ઝિક્યુટિવ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સલામતી પર વડા પ્રધાનના પ્રાથમિક સલાહકાર છે તેમજ વ્યૂહાત્મક મુદ્દાઓની દેખરેખ રાખે છે.

અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા નવેમ્બર 1998 માં પોસ્ટ બનાવવામાં આવી હતી. બ્રજેશ મિશ્રા સૌ પ્રથમ ભારતની એનએસએ તરીકે નિમણૂક કરાયા હતા. પોસ્ટની શરૂઆતથી, , તમામ એનએસએની નિમણૂક ભારતીય વિદેશ સેવા (આઇએફએસ) ને અનુસરે છે, સિવાય કે એમ.કે. નારાયણન અને અશિક્ષિત ડોવલ, જે ભારતીય પોલીસ સેવાના સભ્ય છે..